



## Bhakta Kavi Narsinh Mehta University

Govt. Polytechnic College Campus, Bhakta Kavi Narsinh Mehta University Road,  
Khadiya, Junagadh

Ph. : (O) 0285-2681400

Website : <http://www.bknmu.edu.in>

પરીપત્ર :-

વિષય :- યુ.જી. અને પી.જી. સેમેસ્ટર- ૨, ૪ તેમજ યુ.જી. સેમેસ્ટર - ૫ (પૂરક) ઈન્ટર્નલ/પ્રેક્ટીકલ પરીક્ષાઓનાં માક્સની એન્ટ્રી માટેની પ્રારંભ થવાની તારીખ તથા પૂર્ણ થવાની તારીખ અંગે.

(૧) ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન સર્વે કોલેજોના માનનિય આચાર્યશ્રીઓને અને પી.જી.સેન્ટરના વડાઓને જણાવવાનું કે, માર્ચ-૨૦૧૯ દરમિયાન ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ચાલુ યુ.જી. સેમેસ્ટર-૨ અને પૂર્ણ યુ.જી. સેમેસ્ટર- ૪, પી.જી. સેમેસ્ટર- ૨ અને ૪ તેમજ યુ.જી. સેમેસ્ટર-૫ (પૂરક)ની પરીક્ષા માટેના ઈન્ટર્નલ/પ્રેક્ટીકલ માક્સની એન્ટ્રી માટેની પ્રારંભ થવાની તારીખ તથા પૂર્ણ થવાની તારીખની વિગત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

ક્રમ	પરીક્ષા	એન્ટ્રી પ્રારંભ થવાની તારીખ	એન્ટ્રી પૂર્ણ થવાની તારીખ
૧	યુ.જી. સેમેસ્ટર - ૨ અને ૪(ALL)	૧૮/૦૪/૨૦૧૯	૩૦/૦૪/૨૦૧૯
૨	પી.જી. સેમેસ્ટર -૨ અને ૪ (ALL)	૨૯/૦૪/૨૦૧૯	૦૬/૦૫/૨૦૧૯
૩	યુ.જી. સેમેસ્ટર-૫ (રીમેડીયલ)	૨૯/૦૪/૨૦૧૯	૦૬/૦૫/૨૦૧૯

ઓનલાઈન એન્ટ્રી College User ID તથા Password Enter કર્યા બાદ કરી શકાશે.

(૨) તમામ વિદ્યાશાખાઓનાં રેગ્યુલર વિદ્યાર્થીઓની ઈન્ટર્નલ એન્ટ્રી GIPL નાં સોફ્ટવેરમાં કોલેજોના Login પરથી કરવાની રહેશે

(૩) ખાસ જણાવવાનું કે,

૧. ઉપર્યુક્ત છેલ્લી તારીખ બાદ કરવામાં આવતી એન્ટ્રી સોફ્ટવેર પ્રોગ્રામ સ્વીકારશે નહીં, જે ધ્યાને લેવા વિનંતિ છે

૨. ઈન્ટર્નલ માક્સની એન્ટ્રી પૂર્ણ થયા બાદ કોલેજ/કેન્દ્રએ ચેકલીસ્ટની પ્રિન્ટની ખરાઈ કરી લેવાની રહેશે, છેલ્લી તારીખ બાદ સુધારો કરી શકાશે નહીં. અને જો ભૂલ આવી હશે તો દંડાત્મક ફી ભરી સુધારો કરવાનો રહેશે જેની નોંધ લેવી.

૩. ઈન્ટર્નલ માક્સના ચેકલીસ્ટ આચાર્યશ્રી તથા વિષય અધ્યાપકશ્રી દ્વારા તેને સર્ટીફાઈડ કરીને વિદ્યાર્થીના ધ્યાને જાણ અર્થે નોટીસ બોર્ડ પર મુકવાનું રહેશે.

૪. ઈન્ટર્નલ માક્સની એન્ટ્રી પૂર્ણ થયા બાદ જો કોઈ ભૂલ હોય તો જરૂરી સુધારો કરી, ચેકલીસ્ટની પ્રિન્ટ કાઢી તેની ખરાઈ કરી તેમાં આચાર્યશ્રી તથા વિષય અધ્યાપકશ્રીએ સહી સિક્કા કરી તેને સર્ટીફાઈડ કરીને કોલેજનાં રેકોર્ડ ઉપર રાખવાની રહેશે. યુનિવર્સિટીને જરૂરી લાગશે તો મંગાવે ત્યારે તે નકલ

પરીક્ષા વિભાગમાં જમાં કરાવવાની રહેશે.

પ. યુનિવર્સિટી દ્વારા પરીણામ જાહેર થયા બાદ કોઈ પણ સંજોગોમાં ઈન્ટર્નલ માર્ક્સમાં યુનિવર્સિટી દ્વારા ફેરફાર કરી દેવામાં આવશે નહીં.

૬. ઈન્ટર્નલ માર્ક્સની એન્ટ્રી દરમ્યાનકોલેજ ના User Name તથા Password અપાયેલ છે તેનો જ ઉપયોગ કરવો અને તે માહિતી લીક ન થાય તે અંગેની સંપૂર્ણ જવાબદારી આચાર્યશ્રીની રહેશે જે સવિનય વિદિત થાય.

ઉપર મુજબની જાણ કોલેજના શૈક્ષણિક/બિનશૈક્ષણિક કર્મચારીઓના ધ્યાન ઉપર મુકવા અને જરૂરી વ્યવસ્થા ગોઠવવા યોગ્ય કરશોજી.

નોંધ:- (૧) દરેક કોલેજે ઈન્ટર્નલ માર્ક્સની એન્ટ્રીકર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી કોલેજનાં નોટીસ બોર્ડ ઉપર ફરજિયાત લગાવવાની રહેશે જેથી કરી ને વિદ્યાર્થીઓને પોતાના માર્ક્સમાં કોઈ ભૂલ જણાયતો કોલેજનાં આચાર્યશ્રીનો સંપર્ક કરી શકે અને તેમાં સુધારો કોલેજ દ્વારા કરી લેવાનો રહેશે ત્યાર બાદ કોઈ સુધારો કરી આપવામાં આવશે નહીં. જેની નોંધ લેવી.

(૨) જે વિદ્યાર્થીને વિષય ફેરફાર કરવાનો થતો હોય તેવા વિદ્યાર્થીને ઉત્તરવહિ પર ઇમરજન્સી બારકોડ લગાવી પરીક્ષા અપાવી દેવી અને વણવપરાયેલ બારકોડ અને ઈન્ટર્નલ માર્ક્સ નિયત ફી સાથે યુનિવર્સિટીમાં જમા કરવાના રહેશે.

:- કોલેજ દ્વારા જે વિષયની પ્રયોગિક પરીક્ષાઓના ગુણ કોલેજ એન્ટ્રી કરવાની રહેશે.

પરીક્ષા નિયામક

ક્રમાંક/બીકેએનએમયુ/પરીક્ષા/૦૨/૬૨૬૫ /૨૦૧૯

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,

ગવર્નમેન્ટ પોલીટેકનીક કેમ્પસ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ,

ખડીયા, જૂનાગઢ-૩૬૨૨૬૩

તા. ૧૬/૦૪/૨૦૧૯

પ્રતિ,

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ/પી.જી.સેન્ટરના વડાઓ તરફ...

નકલ સાદર રવાના:-

(૧) માન.કુલપતિશ્રી/ કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી,

નકલ રવાના જાણ તથા યોગ્ય કાર્યવાહી અર્થે:-

(૧) આઈ.ટી. સેલ જરૂરી કાર્યવાહી અર્થે અને વેબસાઈટ પર પ્રસિધ્ધ થવા અર્થે

(૨) એકાઉન્ટ શાખામાં જાણ અર્થે.